

# Applied Physics

1st Test 2017-18

प्र०-१ (a) मूल मात्रक और उत्पन्न मात्रक को समझाएँ ?

उ० :- मूल मात्रक उन मात्रकों का समूह है जो उनके दूसरे से पूर्णतया अवलोकित होते हैं जिन्हें किसी भी अन्य मात्रक से उत्पन्न वा सम्बन्धित ना किया जा सके।

प्र०-२ वल, अर्द्ध, विद्युत आवेश, गुरुत्वाकार नियमों के सूत्र व विभा।

उ० :- (1) वल :-  $\underline{\text{सूत्र}} \rightarrow m \times a = F$  ; विभा  $\rightarrow [M^1 L^1 T^{-2}]$

(2) अर्द्ध :-  $\underline{\text{सूत्र}} \rightarrow mc^2 = E$  ; विभा  $\rightarrow [M^1 L^2 T^{-2}]$ .

(3) विद्युत आवेश :-  $\underline{\text{सूत्र}} \rightarrow Q = IT$  ; विभा  $\rightarrow [M^0 L^0 T^1 A^1]$

(4) गुरुत्वाकार नियमों :-  $\underline{\text{सूत्र}} \rightarrow G = \frac{F \pi^2}{m_1 m_2}$  ; विभा  $\rightarrow [M^{-1} L^3 T^{-2}]$

(c) :- प्रथात्मक किसे कहते हैं?

उ० :- वस्तु के वाहिनी विद्युपत्र वल हटाते ही वस्तु का मूल अवश्यकता करने के लिये की प्रथात्मक कहते हैं।

(d) प्रतिवल किसे कहते हैं?

उ० :- सन्तुलन की अवश्यकता (साम्यावस्था) में वस्तु के अनद्य अनुभव का दृष्टि के साथ द्वितीय ५२ उपन्न आंतरिक प्रतिक्रिया वल को प्रतिवल कहते हैं।

(e) :- दुर्का का नियम।

उ० :- प्रथात्मक सीमा में (अधिकत अल्प विकृति के लिए) प्रतिवल विकृति के समानुपाती होता है।

प्रतिवल व विकृति

प्र० २ :- वायु में घृत का दबा० वा०, वायु का दबा० तथा वायु का धनरूप के बीच क्या सम्बन्ध है, विभिन्न विधि द्वारा संभालने की स्थापना कीजिए ?

उ० ६ :- पूर्णाग्रसार

$$\therefore V \propto P^x d^y$$

$$\Rightarrow V = K P^x d^y \quad \text{--- (1)}$$

$$\text{जैसे } V = \underset{0}{\text{घृत}} \text{ का दबा०}$$

$$P = \underset{0}{\text{वायु}} \text{ दबा०}$$

$$d = \underset{0}{\text{वायु}} \text{ का धनरूप}$$

$$\text{अब, घृत का क्रियात्मक} = [M^0 L^1 T^{-1}]$$

$$\text{वायु का क्रियात्मक} = [M^1 L^{-1} T^{-2}]$$

$$\text{दबा० का क्रियात्मक} = [M^1 L^{-3} T^0]$$

विभिन्न विश्लेषणों विधि -

$$\Rightarrow [M^0 L^1 T^{-1}] = [M^0 L^0 T^0] \cdot [M^1 L^{-1} T^{-2}]^x [M^1 L^{-3} T^0]^y$$

$$\Rightarrow [M^0 L^1 T^{-1}] = [M^x L^{-x} T^{-2x}] [M^y L^{-3y} T^0]$$

$$\Rightarrow [M^0 L^1 T^{-1}] = [M^{x+y} L^{-x-3y} T^{-2x}]$$

अब दबा० का अनुपात ज्ञान करने के लिए

$$x+y = 0 \quad \text{--- (1)}$$

$$-x-3y = 1 \quad \text{--- (2)}$$

$$-2x = -1 \quad \text{--- (3)}$$

अब (3) से अनुपात ज्ञान करने के लिए

$$\begin{aligned} -2x &= -1 \\ x &= \frac{1}{2} \end{aligned}$$

अब मान देने के लिए (1) में लगाने के लिए

$$\alpha + \gamma = 0$$

$$\frac{1}{2} + \gamma = 0$$

$$\boxed{\gamma = -\frac{1}{2}}$$

અહીંનો A નું  $\alpha, \gamma$  કે મળ રહેનું હૈ

$$V = K P^{\alpha} d^{\gamma}$$

$$\Rightarrow V = K P^{\gamma_2} d^{-\gamma_2}$$

$$\Rightarrow \boxed{V = \frac{K P}{d^{\gamma_2}}}$$

प्र०-3 અપ્રેયો ગુણક એવોસો અનુપાત કે સમજાડાય?

જો :- અપ્રેયો ગુણક  $\Rightarrow$  પુલમાર્ગથી સીમા મેં વાશાન પુટિયલ ન અપ્રેયો ગુણક કે અનુપાત કે અપ્રેયો ગુણક નથી

$$\boxed{\text{અપ્રેયો ગુણક} = \frac{\text{અપ્રેયો પુટિયલ}}{\text{અપ્રેયો વિકૃત}}$$

એવોસો અનુપાત  $\Rightarrow$  પુલમાર્ગથી સીમા મેં અનુપદ્વા કાં પાછવ વિકૃત કે અનુદ્દેશ્ય વિકૃત કે અનુપાત નિમન રહેતા હૈ. એવોસો અનુપાત નથી

એવોસો અનુપાત કે  $\sigma = (\text{સીમા})^{\frac{1}{2}}$  નિર્ણયિત રહેતી હૈ.

$$\boxed{\sigma = \frac{\text{અનુદ્વા વિકૃત}}{\text{અનુદ્દેશ્ય વિકૃત}} = \frac{\beta}{\alpha}}$$

માટાનું : — માટાનું રાખી

નિમા : — નિમાનીન

Ques-4 એનું લાદાની કોઈ 4mm માત્રામાં  $2.4 \times 10^{-7} \text{ m}^2$  અનુભવ કરે છે  
બિનામી કોઈ ચાર્ટ નથી હતું અની તેણું કે એનું ગતિ કરી શકતું હૈ ના?  
યુદ્ધભર ના વિસ્તૃત કોઈ પિલાળા કીની? ( $\gamma = 1.8 \times 10^{12} \text{ N/m}^2$ )

Ans- જેવી રૂપી હૈ કે —

$$\text{ચાર્ટ કોઈ પણ કોઈ ગુણીય = } 1.8 \times 10^{12} \text{ N/m}^2$$

$$\text{લાદાની કોઈ માત્રામાં } l = 4\text{ mm}$$

$$\text{અનુભવ કોઈ કોઈ ગતાંત્રમાં } A = 2.4 \times 10^{-7} \text{ m}^2$$

$$G = 36 \text{ N}$$

$$\boxed{\text{યુદ્ધભર} = \frac{F}{A}}$$

$$\text{યુદ્ધભર} = \frac{36}{2.4 \times 10^{-7}}$$

$$\boxed{\text{યુદ્ધભર} = 15 \times 10^7 \text{ N}}$$

$$Y = \frac{F}{A} \cdot \frac{l}{\Delta l}$$

$$1.8 \times 10^{12} = 15 \times 10^7 \times \cancel{\frac{l}{\Delta l}}$$

$$\cancel{\lambda} = \frac{15 \times 10^{12}}{1.8 \times 10^{12}} \cdot \frac{1.8 \times 10^{12}}{15 \times 10^{12}}$$

$$\lambda = .012 \times 10^{-5} = 1.2 \times 10^{-7}$$

જેવી  $F = G$   
 $A = \text{અનુભવ કોઈ કોઈ ગતાંત્રમાં}$   
 $l = લાદાની કોઈ કોઈ માત્રામાં$   
 $\Delta l = \text{ફોર્સી}$

$$Y = \text{ચાર્ટ કોઈ કોઈ ગુણીય}$$